

બાળકો અને 65થી ઓછી ઉંમરના પુખ્તો

NJ ફેમિલીકેર એ NJના રહીશો માટે સાર્વજનિક ભંડોળ મેળવતું સ્વાસ્થ્ય કવરેજ છે. તે મફત અથવા ઓછા દરની ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્યસંભાળ પૂરી પાડે છે. NJ ફેમિલીકેર કાર્યક્રમમાં CHIP, મેડિકેડ અને મોડિકેડ વિસ્તરણ વસ્તીઓનો સમાવેશ થાય છે.

કોને આવરી લેવામાં આવે છે?

NJ ફેમિલીકેર રાજ્ય દ્વારા કરારબદ્ધ સ્વાસ્થ્ય યોજનાઓ દ્વારા પૂરું સ્વાસ્થ્યસંભાળ કવરેજ આપે છે. NJ FamilyCare નીચેના સહિતની મોટાભાગની સ્વાસ્થ્યસંભાળની જરૂરિયાતો આવરી લે છે:

- ડોક્ટરની મુલાકાતો
- એક્સ-રે
- ચર્ચમાં
- ઓટીઝમ સેવાઓ
- પ્રીસ્ક્રિપ્શન્સ
- હોસ્પિટલમાં ભરતી
- માનસિક સ્વાસ્થ્ય સેવાઓ
- સમુદાય રૂલા સેવાઓ
- પ્રયોગશાળા પરીક્ષણો
- ડેન્ટલ
- નિષ્ણાતની મુલાકાતો
- વ્યક્તિગત સંભાળ જરૂરિયાતો માટે મદદ

કોણ લાયક છે:

કોઈપણ ઉંમરના લાયક NJ રહીશો NJ ફેમિલીકેર માટે લાયક હોઈ શકે છે. આમાં બાળકો, માતાપિતા, પાલક સંબંધીઓ અને આશ્રિત બાળકો વિનાના પુખ્તોનો સમાવેશ થાય છે. યોગ્યતા આવક અને ઘરના કદ પર આધારિત હોય છે જે અરજદારના તાજેતર ફેડરલ ટેક્સ રિટર્નમાં નોંધાઈ હોય. જોકે, NJ ફેમિલીકેર માહિતીની ખરાઈ કરવા માટે પગારની રસીદો જેવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે છે. બાળકો માટે આવકની યોગ્યતા પુખ્તો માટે આવકની યોગ્યતા કરતા વધારે હોય છે. (જુઓ ચાર્ટ)

તેમાં કેટલો ખર્ચ થાય છે?

ઘણા લોકો માટે, NJ ફેમિલીકેરનો કોઈ ખર્ચ થશે નહીં. બાળકો ધરાવતા ઉચ્ચ અવાક વાળા પરિવારો માટે સહ-ચુકવણી માટે એક સ્વાઈચિંગ સ્કેલ છે.

શું કોઈપણ અંકુશો છે?

પૂર્વ-અસ્તિત્વમાં રહેલી શરતો પાત્રતાને અસર કરતી નથી.

વયસ્કોને પાત્ર બનવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કાયદેસર (કાનૂની) કાયમી નિવાસી દરજ્જો હોવો આવશ્યક છે. બાળકો અને સગર્ભા સ્ત્રીઓ, યુએસમાં પ્રવેશની તેમની તારીખને ધ્યાનમાં લીધા વિના, જો તેઓ કાયદેસર (કાનૂની) રહેવાસી હોઈ તો પાત્ર બની શકે છે. બિનદસ્તાવેજી રહેવાસીઓ માટે, જો તેમના બાળકો પાસે લાયક (કવાલફાઈડ) ઈમગ્રેશન સ્ટેટ્સ અથવા યુ.એસ. માં જન્મેલા હોય તો પાત્ર બની શકે છે.

વધુ માહિતી કેવી રીતે મેળવવી?

તમે લાયક છો કે નહીં તે શોધવા માટે અથવા વધુ માહિતી માટે કૉલ કરો અથવા અમારી વેબસાઈટની મુલાકાત લો.

1-800-701-0710 (TTY: 711)

(બહુભાષી ઓપરેટરો ઉપલબ્ધ છે)

ઓનલાઈન અરજી કરો!

www.njfamilycare.org

જાન્યુઆરી 1, 2022 પ્રમાણે મહત્તમ માસિક આવક

કુટુંબનું કદ અને તમારા ફેડરલ ટેક્સ પર નોંધાયેલી માસિક આવક

કુટુંબનું કદ*	બાળકો (19થી ઓછી ઉંમર)	માતાપિતા અને અપરિણીત પુખ્તો (ઉંમર 19-64)	ગર્ભવતી મહિલાઓ (કોઈપણ ઉંમર)
1	\$ 4,021	\$ 1,563	લાગુ નથી
2	\$ 5,417	\$ 2,106	\$ 3,128
3	\$ 6,814	\$ 2,649	\$ 3,935
4	\$ 8,210	\$ 3,192	\$ 4,741
5	\$ 9,606	\$ 3,735	\$ 5,547
6	\$ 11,003	\$ 4,277	\$ 6,354
પ્રત્યેક વધારાનો સભ્ય	\$ 1,397	\$ 543	\$ 807

* તમારા કુટુંબનું કદ માતાપિતા અથવા પાલક(કો) અને જેઓ કર આશ્રિત હોય તેવા 21થી ઓછી ઉંમરના લોહીની સગાઈ ધરાવતા બધા બાળકો તેમજ તમારા ઘરમાં રહેતા અન્ય કર આશ્રિતની કુલ સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવી શકે છે.